

જાન્યુઆરી 24, 2019

**ગૌર મેડોસ ક્વર્ડ આઉટડોર આઈસ રિન્કની
ઔપચારિક ભવ્ય શરૂઆતની ઉજવણી!**

**રહેવાસીઓ અને મુલાકાતીઓને રિબન-કાપીને ઉદઘાટન અને બ્રામ્પટનની પહેલી ક્વર્ડ આઉટડોર આઈસ
રિન્કમાં મજની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું નિમંત્રણ આપવામાં આવે છે.**

બ્રામ્પટન, ઓન્ટેરિયો – બ્રામ્પટનની નવી ક્વર્ડ આઉટડોર આઈસ રિન્કમાં એક બપોરે મફત કૌટુંબિક મોજમજ માણવા તમારા સ્કેટ્સ બાંધીને આવો!

રવિવાર, ફેબ્રુઆરી 3, 2019 નાં રોજ, બપોરે 1 થી 4 વાગ્યા સુધી, સીટી ઓફ બ્રામ્પટન ગૌર મેડોસમાં ભવ્ય ઉદઘાટન સાથે શરૂઆતનું આયોજન આ સરનામે કરી રહ્યું છે, 10150 The Gore Road (ધી ગૌર રોડ સ્થિત કેસલમોર રોડની ઉત્તરે).

કુટુંબોને મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને કાઉન્સિલર્સ સાથે બપોરે 1 વાગ્યે ઔપચારિક રિબન-કાપીને ઉદઘાટનમાં હાજર રહેવાનું નિમંત્રણ આપવામાં આવે છે, જે પછી શ્રેણીબદ્ધ કુટુંબોને અનુકૂળ આઉટડોર અને ઈનડોર પ્રવૃત્તિઓ યોજાશે.

આઉટડોર પ્રવૃત્તિઓમાં સામેલ છે:

- મફત હોટ ચોકલેટ અને કોફી
- ટીમ હોર્ટન્સ (Tim Hortons) દ્વારા રજૂ મફત સ્કેટિંગ
- માર્શમેલો રોસ્ટિંગ ફાયર પિટ્સ
- આઈસ કાર્વિંગ (બરફ કોતરણીકામના) પ્રદર્શનો
- CN દ્વારા રજૂ #MyBrampton ચિલ્ડન સાથેની છબીઓ
- સ્મોક'સ પુટિનીયર ફૂડ ટ્રક જ્યાં હાજર મુલાકાતીઓ ખાદ્ય પદાર્થો ખરીદી શકે છે

ડીજે ટેમ (DJ Tam) સમગ્ર પ્રસંગ માટે બહારની બાજુએ ફરશે, અને હાજર મુલાકાતીઓ બ્રામ્પટન ટ્રાન્ઝિટ બસમાં હૂંફ મેળવી શકે છે.

ગૌર મેડોસ કમ્યુનિટી સેન્ટર અને લાઈબ્રેરીમાં ઈનડોર પ્રવૃત્તિઓમાં સામેલ છે:

- પુસ્તકાલયમાં બપોરે 2 વાગ્યે લેખક વાંચન કેવિન સિલ્વેસ્ટર (Kevin Sylvester) દ્વારા
- એરબ્રશ ટેટૂ
- ક્રાફ્ટ સ્ટેશન
- મફત કોટન કેન્ડી વિતરણ
- ઈબી ગેમ્સ (EB Games) દ્વારા પ્રસ્તુત, ઈબી ગેમ્સ યુથ લોન્જમાં વીડિયો ગેમ્સ
- ફેમિલી બાસ્કેટબોલ અને ફેમિલી જુમ્બા
- બ્રામ્પટન ફાયર પ્રિવેન્શન ટીમ અને સ્પાર્ક ધી ડોગને મળવું

બ્રામ્પટનમાં આ અદ્વિતીય ક્વર્ડ આઉટડોર આઈસ રિન્ક 143 એકર જમીનમાં [ગૌર મેડોસ કમ્યુનિટી સેન્ટર અને લાઈબ્રેરી](#)ને અડીને આવેલી છે.

આ રિન્કની અજોડ બનાવટ ગેલ્વેનાઈઝડ સ્ટીલ અને ગ્લુલમની (તોરણાકાર લાકડાની પાટડીઓની) સાથે સાથે ધાતુની ડેક, એક કોન્ક્રીટ પેડ અને પૂરા અરેના બોર્ડર્સની બનેલી છે. આ અજોડ છાપરાનું આવરણ અને ડિઝાઇન બનાવટી બરફને બાહરી તત્વો, ખાસ કરીને સૂર્યથી સંરક્ષણ આપે છે, જે શિયાળામાં બરફ વધારે નરમ બનાવી શકે છે.

આઉટડોર રિન્ક સગવડોમાં બે પહોંચ સુલભ વોશરૂમ્સ અને લોકર્સ સાથે એક યુનિવર્સલ ચેન્જ રૂમનો સમાવેશ થાય છે. પર્સનલ સાઉન્ડ એમ્બલિક્સાઈંગ ડિવાઈસીસ (અંગત ધ્વનિવર્ધક સાધનો) અને સાંભળવામાં સહાયરૂપ ઈયરફોન્સ પણ સાંભળવાની સમસ્યા ધરાવતા પેટ્રન સભ્યો સ્કેટ કરે ત્યારે તેઓ માટે ઉપલબ્ધ છે.

બહુ ઠંડાગાર મહિનાઓમાં, રિન્કને લેઈઝર હોકી, પબ્લિક સ્કેટ્સ, લેશન્સ અને શાઈની કદને અનુરૂપ બનાવાઈ છે. ઉનાળામાં, આ જગ્યાને આયોજનો, મનોરંજન કાર્યક્રમો, કેમ્પ્સ અને બૉલ હોકીમાં પરિવર્તિત કરી શકાય છે.

આ રિન્ક હવે ડ્રોપ-ઇન-શાઈની અને પબ્લિક સ્કેટ્સ માટે ઉપલબ્ધ છે. કાર્યક્રમના સમયપત્રક માટે, [અહીં ક્લિક કરો](#). રિન્ક રેન્ટલ્સ માટે, સંપર્ક કરો goremeadows@brampton.ca.

ગૉર મેડોસ ક્વર્ડ આઉટડોર આઈસ રિન્કની ઔપચારિક ભવ્ય શરૂઆત પર વધુ માહિતી મેળવવા, [અહીં ક્લિક કરો](#).

અવતરણ (ક્વૉટ):

“કાઉન્સિલના સભ્યો અને હું ગૉર મેડોસ ક્વર્ડ આઉટડોર આઈસ રિન્કની ઔપચારિક ભવ્ય શરૂઆત ઉજવવા બહુ રોમાંચિત છીએ. આ અજોડ, ઢંકાયેલી આઉટડોર રિન્ક બ્રામ્પટનમાં અજોડ છે. તમારા સ્કેટ્સ બાંધીને આવો અને અમારી સાથે બપોરે મોજમજા, કૌટુંબિક અનુકૂળ પ્રવૃત્તિઓ માણવા જોડાઈ જાવ!”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો યાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca